https://archive.org/details/bk1066/page/n0/mode/1up

1945-09-04 -Bhuj Swaminarayan Sadhu Against Diksha to KKP Sadhu (1066)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

RKK-40

૮૧ ✓ શ્રીસ્વામીનારાયણોવિજયતેતરામ્ (અસલ ઉપરથી નકલ)

સ્વસ્તિ શ્રી અમદાવાદ મહાશુભસ્થાને ઉત્તમો ઉત્તમ કૃતનિવાસ પરમપવિત્ર
પરમ પુજ્ય શુભ શુભ વિરદે વાન ધર્મકુળ તીલક ધર્મવંશ મુગટમણી
ભાજ શ્રી નરપે કૃત સ્વધર્મ મર્યાદા સ્થાપન તત્પર શ્રીમદ્ભક્તિ ધર્મ નંદન ચરણા
વિંદ બુદ્ધ માનસ ભૃંગ ભાગવદ્ ધર્મ ભક્ત પરમ દયાળુ એવંગુણોપ
મા યોગ્ય ગુરુરાજ ધર્મધુરંધર ધર્મ આચાર્ય શ્રી ૧૦૮ ધર્મ મારતંડ શ્રી
દેવેન્દ્રપ્રસાદજી મહારાજ ચરણ કમળ સમીપ સભામાં એતાન શ્રી નરનારાયણ
દેવ ચરણ કમળ સમીપ શ્રી ભુજનગરથી લી. આપના ચરણારવિંદ સેવક
સાધુઓ તથા હરી ભક્તો (કચ્છ) દેશના સાષ્ટાંગ દંડવત પ્રણામ પુર્વક જય શ્રી સ્વામીના
રાયણ વાંચશો. અત્રે આપની કૃપાથી કુશળતા વર્તે છે. સંતો હરીભક્તો સુખેથી શ્રી
મહારાજનું ભજન સ્મરણ કરે છે. આપનો કુશળતાનો પત્ર. તા-૨૨-૮-૪૫નો કોઠા
રી ઈશ્વરભાઈ મગનભાઈના હસ્તનો લખાવેલો મળ્યો.
અંજડીઆના ગામ શ્રી રવાપુર ગઢાળી દયાપુર વિગેરા ગામના કણબીઓએ સાધુની
પગતમાં ભેળવવા સબંધી આપ પાસે અરજી કરાવી છે. રજુ કરેલ હકીકત જુઠી છે. અને
તે બાબત કાંઈ પયું નથી. સં ૧૯૮૩ ની સાલમાં આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ અત્રે
પધારેલ તે વખતે મહારાજ શ્રી રૂબરૂ તે લોકોએ સાધુ દીક્ષા આપવા અરજ કરેલ હતી ત્યારે
મહારાજ શ્રી તરફથી ચોખ્ખું કહેવામાં આવ્યું કે તમારી કોમને સાધુ દીક્ષા આપી શકાય નહીં
આવો ચોખ્ખો જવાબ આપેલો છે. એ પ્રમાણે પ્રણાલ મર્યાદા પળાયેલી છે. એટલે તે બાબત કાંઈ
કરવાનું રહેતું નથી. અર્થાત સાધુ દીક્ષા આપી શકાતી નથી. એજ વિનતી ત્યાં સંતો હરીભક્તો સર્વે
~~[illegible]~~ ને જય શ્રી સ્વામીનારાયણ કહેશો. અત્રેથી સર્વને વાંચસો. મતી શ્રાવણ વદ ૧૩
મંગળ સં. ૨૦૦૨ તા-૪-૯-૪૫ સાધુ શ્રીવલ્લભદાસજી સહી દા. પોતાના. સાધુ નારા
યણદાસજીની સહી દા. સાધુ ધર્મજીવનદાસના સ્વામીના કહેવાથી. સાધુ ધર્મજીવનદાસની
સહી દા. પોતાના સાધુ ભક્તિવલ્લભદાસની સહી દા પોતે. સાધુ કૃષ્ણકેસવદાસની સહી દા સાધુ ભક્તિ
વલ્લભદાસના સ્વામીના કહેવાથી સાધુ મોરલી મનોહરદાસની સહી દા. પોતાના સાધુ રૂપસ્વરૂ
પદાસની સહી દા. પોતાના સાધુ ધર્મકીશોરદાસની સહી દા. પોતાના સાધુ ઘનશ્યામપ્રીયદાસની
સહી દા સાધુ શ્રીહરીદાસના સાધુ લક્ષ્મીનારાયણદાસની સહી દા. પાર્ષદ શાંમજી ભક્તના
સાધુ કૃષ્ણદાસની સહી દા. પોતાના સાધુ ગંગાજીવનદાસની સહી દા પોતાના સાધુ નારાય
ણપ્રસાદદાસની સહી દા. પોતાના સાધુ તદ્રૂપદાસજીની સહી દા. ભોગીલાલ સાધુ દીપકવલ્લભદા
સની સહી દા. પાર્ષદ શામજી ભગતના સાધુ મોહનદાસજીની સહી દા. પોતાના માસ્તર નરસીંમંગ
જી સહી દા. પોતાના કોઠારી પ્રાણલાલ જીવણ દા. પોતાના નથુ રાઘવજીની સહી દા. પોતાના
શેઠ હીરાલાલની સહી દા. પોતાના મોરારલાલ પ્રેમ શંકરની સહી દા. પોતાના શેઠ શંકરલાલ
ગોવિંદભાઈની સહી દા. પોતાના કચરા મનોહર માવજી સહી દા. પોતાના સોની વાઘજી મોન
જી સહી દા. પોતાના શેઠ નાંથાલાલ ગોવિંદભાઈની સહી દા. પોતાના ઠા. શેઠ વેલજીની સહી
દા. પોતાના મેતા માણેકલાલ ભાઈ દા. પોતાના મેતા રામ વાઘજીની સહી દા. પોતાના
ઠ. જાદવજી પાનાંચંદ દા. પોતાના નાગર ભુવનદાસભાઈની સહી દા. પોતાના ઠ. મથુરદાસ ખુદરજી

https://archive.org/details/bk1066/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1066/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 17:31:53 +05'30'

Real Patidar
Unravel Truth

RKK-40

૮૮ ✓ શ્રીસ્વામીનારાયણો વિજયતેતરામ્ (અમદાવાદ ઉપર રાજકોટ)

Letter Date 04-Sep-1945 -by Sadhus of Bhuj Swaminarayan Temple to Main Ahmedabad Swaminarayan Temple

realpatidar.com

સ્વસ્તિ શ્રી અમદાવાદ મહાશુભસ્થાને ઉત્તમો ઉત્તમ કૃતનિવાસ પરમપવિત્ર પરમ પુજ્ય શુભ શુભ વિવેકવાન ધર્મ કુળ તાલક ધર્મ વંશ મુગટમણી ભાગ્ય નિત્યપ્રતિ કૃત સ્વધર્મ મર્યાદા સ્થાપન તત્પર શ્રી ભક્તિ ધર્મ નંદન ચરણ વિંદ લુબ્ધ માનસ ભૃંગ ભાગવત ધર્મ અષ્ટ પરમ દયાળુ અનેક શુભોપમા યોગ્ય ગુરુરાજ ધર્મ ધુરંધર ધર્મ આચાર્ય શ્રી ૧૦૮ ધર્મ મારતંડ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજ ચરણ કમળ સમીપ સમામાં એતાન શ્રી નરનારાયણ દેવ ચરણ કમળ સમીપ શ્રી ભુજનગરથી લી. આપના ચરણરજ સેવક સાધુઓ તથા હરિભક્તો (કચ્છ) દેશના આલાગ. દંડવત પ્રણામ પુર્વક જય શ્રીસ્વામીનારાયણ વાંચશો. અત્રે આપની કૃપાથી કુશળતા વર્તે છે. સંતો હરિભક્તો સુખેથી શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરે છે. આપનો કુશળતાનો પત્ર તા-૨૨-૮-૪૫-નો કોઠારી શ્રી ઈશ્વરભાઈ મગનભાઈના હસ્તનો લખાયેલો મળ્યો.

અબડાસાના ગામ શ્રી રવાપુર ગડાણ દયાપુર વગેરે ગામના કણબીઓએ સાધુની પંક્તિમાં ભળવા સબંધી આપ પાસે અરજી કરાવી રજુ કરેલ હકીકત જાણી છે અને તે બાબત કાંઈ પણ નથી. શા. ૧૯૪૩ ની સાલમાં આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ અત્રે પધારેલ તે વખતે મહારાજ શ્રી કણબી તેલીઓએ સાધુ દીક્ષા આપવા અરજ કરેલ હતી ત્યારે મહારાજ શ્રી તરફથી ચોખ્ખું કહેવામાં આવ્યું કે તમારી કોમને સાધુ દીક્ષા આપી શકાય નહી. આવો ચોખ્ખો જવાબ આપેલ છે. એ પ્રમાણે પૂર્વજ મર્યાદા ચાલી આવી છે. એટલે તે બાબત કાંઈ કરવાનું રહેતું નથી. અર્થાત સાધુ દીક્ષા આપી શકાતી નથી. એજ વિનંતી ત્યાં સંતો હરિભક્તો સર્વેને જય શ્રીસ્વામીનારાયણ કહેશો. અત્રેથી સર્વના વાંચશો. મતી શ્રાવણ વદ ૧૩ મંગળ સં. ૨૦૦૧ તા-૪-૯-૪૫

Year: 1886-87

સાધુ શ્રીવલ્લભદાસજી સહીદા. પોતાના. સાધુ નારાયણ કૃષ્ણદાસજીના સહીદા. સાધુ ધર્મજીવનદાસ સ્વામીના કહેવાથી. સાધુ ધર્મજીવનદાસની સહીદા. પોતાના સાધુ ભક્તિવલ્લભદાસની સહીદા પોતે. સાધુ કૃષ્ણકેશવદાસની સહીદા સાધુ ભક્તિવલ્લભદાસના સ્વામીના કહેવાથી સાધુ મોરલી મનોહરદાસની સહીદા. પોતાના સાધુ દેવસ્વરૂપદાસની સહીદા. પોતાના સાધુ ધર્મજીશોરદાસની સહીદા. પોતાના સાધુ ઘનશ્યામપ્રીયદાસની સહીદા સાધુ શ્રીહરીદાસના સાધુ લક્ષ્મીનારાયણદાસની સહીદા. પાર્ષદ શાંમજી ભક્તના સાધુ કરૂણકૃષ્ણદાસની સહીદા. પોતાના સાધુ જગજીવનદાસની સહીદા પોતાના સાધુ આશય પ્રસાદદાસની સહીદા. પોતાના સાધુ તદરૂપદાસજીની સહીદા. ભોગીલાલ સાધુ કરીષ્ણમદાસની સહીદા પાર્ષદ શાંમજી ભગતના સાધુ મોહનદાસજીની સહીદા. પોતાના મીસ્ત્રી નેરંભરંભજી સહીદા પોતાના કોઠારી પ્રેમલાલ જીવણદાસ પોતાના અનંતરાઘવજીની સહીદા. પોતાના જેઠી હીરાલાલની સહીદ પોતાના મોરબાલાલ વેલજી રતનશીની સહીદા. પોતાના જેઠી શંકરલાલ ગોપાલભાઈની સહીદા. પોતાના કચાંધ મનોહર માવજી સહીદા. પોતાના શેઠ વાલજી મોહનજી સહીદા. પોતાના જેઠા નાંમાલાલ ગોપાલભાઈની સહીદા. પોતાના ઠા. નેરાઘવજીની સહી દા. પોતાના મેતા માણેકલાલ ભાઈ દા. પોતાના મેતા રામ વાઘજીની સહીદા. પોતાના ઠ. જાદવજી પાનાંચંદ દા. પોતાના જગસાર મુળજી તથા નારણજી સહીદા. પોતાના ઠ. મથુરદાસ ગુરુદાસ

realpatidar.com

https://archive.org/details/bk1066/page/n3/mode/1up

RKK-41

સુતાર વાલજી મોરારજી મુળજી સહી દા. પોતાંના ગોર કેસવલાલ જે શંકરના સહી દા. પોતાંના
શા. માધવજી કરમશીના સહી દા. પોતાંના ઠ. ધનજી લાલજી મશરૂના સહી દા. ઠ. ખીમજી દેવજીના
જી ઠ. ભીમજી દેવજીના સહી દા. પોતાંના

ગુર્જર સુતાર ભાણજી લાધા/પ્રેમજી સહી દા. પોતાંના ઉપાધ્યાય પ્રભાશંકર ગંગાજી ઠાકર સહી
દા. પોતાના મિસ્ત્રી હીરા કાનજી મનજી મોઈયાણું. ગામ માં મકવાણા પાનાચંદ મેઘજીના
સહી દા. પોતાંના કુ. ઉમેદ કરસન નારાયણના સહી દા. પોતાંના કુ. જેઠા રામજીના સહી દા.
પોતાંના. ગામ શ્રી સુજાપુર પ. રતનજી લધાના સહી દા. પોતાંના. પ. હીરા લાલજીના સહી દા.
રતનજી લધાના પા. મુળજી રવજી દા. પોતાંના પા. મુળજી ગોપાલના સહી દા. મુળજી રવજીના કુ. ઉમેદ
જી વાલજીના સહી દા. પોતાંના કુ. જીવા ખોડાના સહી દા. રામજી વાલજીના પા. પરબત પ્રેમજીના સહી
દા. પોતાંના. કુ. માવજી કરસનના સહી દા. પોતાંના કુ. કાનજી કરસનના સહી દા. પોતાંના. કુ. કરસન માવજી
ના સહી દા. પોતાંના કુ. લાલજી કુંવરજીના સહી દા. પોતાંના કુ. રામજી પુંજાના સહી દા. પોતાંના કુ. દેવજી
લધાના સહી દા. પોતાંના કુ. દેવજી કુંવરજીના સહી દા. ~~[illegible]~~ માવજી કરસનના. ગામ માધાપુરના
કુ. મનજી નારાયણના સહી દા. પોતાંના કુ. રવજી ભીમજી દા. પોતાંના નારાયણ વાલજીના સહી દા.
પોતાંના કુ. મુળજી દેવજીના સહી દા. પોતાંના કુ. વાલજી મેઘજીના સહી દા. મુળજી દેવજીના ધણીના
કહેવાથી કુ. કાનજી મેઘજીના સહી દા. મુળજી દેવજીના કુ. ગોપાલ ઉમેદના સહી દા. પોતાંના.
ગામ શ્રી સુખપુર ખાઈ ટેકરી કુ. રતના જેઠાના સહી દા. રવજી રામજીના કુ. રૂડા દેવશીના
સહી દા. મુળજી દેવજીના ધણીના કહેવાથી. ગામ શ્રી મેઘપુર પા. પ્રેમજી રવજીના સહી દા. રવજી
રામજીના ધણીના કહેવાથી. કુ. નાથા ભીમજીના સહી દા. પોતાંના કુ. રતનજી રવજીના સહી દા.
પોતાંના. ગામ શ્રી રામપુર. માવજી કેશરાના સહી દા. નાથા નાંનજીના કુ. મુળજી નારા
યણના સહી દા. પ્રેમજી રામજીના ધણીના કહેવાથી. ગામ દહીંસરા. નારાયણ દેવજીના
સહી દા. પોતાંના કુ. હીરજી રામજી દા. પોતાંના. ગામ ગોડપુર. પા. ધનજી કરસન
સહી દા. પોતાંના કુ. રામજી હીરાના સહી દા. ધનજી કરસનના પા. કુંવરજી નારાયણના સહી
દા. પોતાંના કુ. કરમણ મુળજી. કાનજી મુળજીના ધણીના કહેવાથી. કુ. કાનજી રામ
ના સહી દા. પોતાંના કુ. લખમણ જીવાભાઈના સહી દા. કુંવરજી નારાયણ કુ. રામજી નારાયણ
કુંવરજીના કુ. નથુ માવજીના સહી દા. પોતાંના. ગામ શ્રી સુરજપુર. કુ. ધનજી રતના
ના સહી દા. પોતાંના. ગામ જાદુરા. પ. ~~[illegible]~~ કુંવરજી દા. પોતાંના કુ. રામજી
દેવજીના સહી દા. પોતાંના કુ. કરસન રામજીના સહી દા. પોતાંના કુ. રામજી ખેંગાર દાના
રામજી મુળજીના કુ. ~~[illegible]~~ રામજી મુળજીના સહી દા. પોતાંના ઠા. માવજી લાલજી
ના સહી દા. પોતાંના. ગામ કેરા. ગોપાલ ડોસાના સહી જેઠા રામજી ધણીના કહેવાથી
ગામ કોડકી. કુ. રવજી મુળજીના સહી દા. પોતાંના કુ. હીરજી રામજીના સહી દા. રવજી મુળજી
ના ધણીના કહેવાથી કુ. ગોપાલ લાલજી [illegible] વાલજીના સહી દા. પોતાંના.

realpatidar.com